

Date: 2nd June, 2021

To,
Corporate Relations Department,
Bombay Stock Exchange, PJ Towers,
Dalal Street, Mumbai - 400001,
Maharashtra, India

Scrip Code: 540063

Subject: Newspaper Clippings of Advertisement published in Newspaper(s)

Dear Sir/ Ma'am,

We are submitting herewith the clippings of advertisement(s) published in Free Press Gujarat and Lokmitra for Financial Results of the Company for the Quarter and Year ended on 31.03.2021

This is for your kind information and records.

Thanking You,

Yours faithfully
For, **ECS Biztech Limited**


Geetika Bisht
Company Secretary
ACS 48713



ECS Biztech Limited.

Regd. Office: The First, B02, ECS Corporate House, Behind Keshavbaug Party Plot, Off. 132 ft Ring Road, Vastrapur, Ahmedabad- 380015. Gujarat. India.
Phone: 8980005006 / 8980004000 | Web: www.ecscorporation.com
CIN: L30007GJ2010PLC063070

RATION KITS DISTRIBUTED TO RAILWAY SAHAYAKS BY WRWFO

Toxic gas leak triggers panic near Vavta GIDC in Ahmedabad



Smt. Tanuja Kansal - President of WRWFO distributed Ration Kits to the Railway Sahayaks at Bandra Terminus. 2nd pic is of Smt Kansal with Smt Sheela Satya Kumar, Executive Committee Members and Railway Sahayaks.

Smt. Tanuja Kansal - President of Western Railway Women's Welfare Organisation addressing the Railway Sahayaks at Bandra Terminus.

Ahmedabad, Western Railway Women Welfare Organisation (WRWFO), not only provides help to railway employees and their families, but also is in the forefront when it comes to helping the weaker sections of the

society. On 29th June, 2021, Smt. Tanuja Kansal - President of Western Railway Women's Welfare Organisation distributed ration kits to 84 Railway Sahayaks (Coolies) at Bandra Terminus railway station.

According to a press release issued by Shri Sumit Thakur - Chief Public Relations Officer of Western Railway, the Ration Kits were distributed to the Sahayaks of

Bandra Terminus railway station. Due to the pandemic and partial lockdown, the economic condition of the Sahayaks is affected adversely, due to which they are facing a lot of hardships. As a benevolent gesture, WRWFO decided to provide assistance to the Sahayaks. The programme commenced with the welcome of Smt Tanuja Kansal - President WRWFO by Smt. Sheela Satya Kumar, President WRWFO of Mumbai Division. Smt Kansal was presented with a Shawl and Coconut by the Mukhadam of Sahayaks as a token of respect and gratitude. Smt Kansal in her address to the Sahayaks, expressed her heartfelt sympathy towards them, since they are unable to earn enough because of the current pandemic situation. She said that she was very happy to meet them and it has always been the endeavor of WRWFO to provide assistance to people in need, especially those who are part of the Western Railway family. She applauded the Sahayaks, as they, with their industrious labour, ensure to help passengers carry their luggage making travel more comfortable.

were overwhelmed by this noble gesture of WRWFO and expressed their gratitude towards this generosity.

complaining of burning in the eyes, difficulty in breathing and nausea. Chaos ensued as the symptoms aggravated. On getting information of the gas leak, teams of Ahmedabad Fire and Emergency Services (AFES), city police and Gujarat Pollution Control Board (GPCB) rushed to the spot. They inspected eight companies but could not find out about its source. Subsequently, they placed four machines to detect the gas. However, former Hatjinar coporator Atul Patel said these machines would not be able to provide any clarity on the source of the leak. Patel had informed the AFES, GPCB and police about the gas leak following a complaint by Machhunar resident Bharat Bhawad. "Two residents had to be taken to LG Hospital after facing increased difficulty in breathing. However, after breathing fresh air on the way, they felt better and were brought back home. Others complained of burning sensation in the eyes and nausea," said Patel. Sources claim that factories often open the gas valve late in the night to release toxic gases. Such a situation would arise if the valve was left open for a longer period.

REAL STRIPS LIMITED

Registered Office: Survey No.245-246, Village Sari, Ahmedabad-Bavla Highway, Taluka Sanand, Dist.: Ahmedabad - 382220, Gujarat.
CIN: L27100G1990P0014383
Telephone: +91 92280 02011, +91 92280 02012
Email: ramcharan@realstrips.com, www.realstrips.com
Com. No. Bombay Stock Exchange - 153558

Extract of Audited Financial Results for the Quarter and Year Ended 31st March 2021

PARTICULARS	Quarter Ended		Year Ended	
	31.03.2021 (Refer Note No. 12)	31.12.2020	31.03.2020	31.03.2021
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)
Total Income from operations	4,040.36	4,008.45	2,585.87	12,503.01
Net Profit/(Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	(1,572.63)	148.39	(44.24)	(1,341.77)
Net Profit/(Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	(1,572.63)	148.39	(44.24)	(1,341.77)
Net Profit/(Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	(1,630.49)	148.39	(157.83)	(1,399.63)
Total Comprehensive Income for the period (comprising profit for the period after tax and other comprehensive income after tax)	18.83	-	(5.75)	18.83
Equity Share Capital (Face value of Rs.10/- each)	597.50	597.50	597.50	597.50
Other Equity (excluding Reserve and Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	(3,062.72)
Earnings Per Share (For Continuing and Discontinued operations) (Amount in Rs.)	(27.27)	2.48	(2.64)	(23.41)
- Basic & Diluted (Not annualised)	(27.27)	2.48	(2.64)	(23.41)

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.realstrips.com)
2. The Hon'ble NCLT, Ahmedabad Bench vide order dated 9th March, 2021 passed an CR (18)No. 3077/NCLT/AHM/2020 initiated the Corporate Insolvency Resolution Process (CIRP) under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. Mr. Ramcharan Dhallam Choudhary has been appointed as the Resolution Professional (RP) by the Committee of Creditors (CoC). The RP has relied on the assistance provided by the members of the Audit Committee in view of the financial results and certifications, representations and statements made by the directors of the company in relation to these financial statements. The RP has taken on record the financial statements of the company in good faith and only to the limited extent of discharging the powers of the Board of Directors of the company which has been conferred upon him under Section 17 of the Insolvency and Bankruptcy Code, 2016.
3. The company had defaulted in the repayment of loan amounting to Rs 7,700.00 Lakhs being principal amount during the period from October 7, 2019 till March 31, 2021 and Rs 1,721.55 Lakhs towards interest during the period from October 7, 2019 till March 31, 2021 to the financial creditor namely Rajratna Metal Industries Limited. Accordingly, Rajratna Metal Industries Limited filed a petition before the Hon'ble National Company Law Tribunal (NCLT), Ahmedabad Bench under section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 (IBC, 2016) read with the rule 4 of the Insolvency and Bankruptcy Code (Application to the Adjudicating Authority) Rules, 2016 to initiate insolvency resolution process against the Corporate Debtor. Further, on March 9, 2021, the Hon'ble NCLT, Ahmedabad Bench had admitted the petition filed by financial creditor for initiation of Corporate Insolvency Resolution process (CIRP) under the Insolvency and Bankruptcy Code, 2016 (IBC) and appointed Mr. Ramcharan Dhallam Choudhary as the Interim Resolution Professional (IRP). Thereafter, in its first meeting of committee of creditors (CoC) held on 08th April, 2021, the members of the Committee of Creditors approved the appointment of Mr. Ramcharan Dhallam Choudhary as Resolution Professional (RP) to carry out the functions entrusted by the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, Rules and Regulations thereto. Further, in accordance with the provisions of section 23 of the IBC, 2016, the resolution professional shall conduct the entire corporate insolvency resolution process and manage the operations of the corporate debtor during the insolvency resolution process period. Further, the resolution professional shall continue to manage the operations of the corporate debtor until an order approving the resolution plan under sub-section (1) of section 31 or appointing a liquidator under section 34 is passed by the Adjudicating Authority.
With respect to the financial results for the quarter and year ended March 31, 2021, the RP has signed the same solely for the purpose of ensuring compliance with the provisions of the Insolvency and Bankruptcy Code, 2016, Rules and Regulations thereto.
4. The RP has furnished and signed the report in good faith and accordingly, no suit, prosecution or other legal proceeding shall lie against the RP in terms of Section 233 of the Code;
b) No statement, fact, information (whether current or historical) or opinion contained herein should be construed as a representation or warranty, express or implied, by the RP, including his authorized representatives and advisors.
c) The RP, in review of the financial results and while signing this statement of financial results, has relied upon the assistance provided by the directors of the Corporate Debtor, and certifications, representations and statements made by the directors of the Corporate Debtor, in relation to these financial results. The statement of financial results of the Corporate Debtor for the quarter and year ended March 31, 2021, have been prepared and signed by the RP solely in reliance on the financial results, representations and statements of the directors and the erstwhile management of the Corporate Debtor. For all such information and data, the RP has assumed that such information and data are in the conformity with the Companies Act, 2013 and other applicable laws with respect to the preparation of the financial results and that they give true and fair view of the position of the Corporate Debtor as of the dates and period indicated therein. Accordingly, the RP is not making any representations regarding accuracy, veracity or completeness of the data or information in the financial results. "As per the requirement of the "IBC, 2016" and "CIRP Regulations" Resolution Professional has invited expression of Interest (EOI) from prospective Resolutions Applicants (PRAs) to submit the Resolution Plan for the Company. The resolution plan received was placed in the third meeting of CoC held on June 25, 2021 and was discussed. The same has been put for voting and the result is pending.
5. The financial results for the quarter and year ended at March 31, 2021, have been prepared by the management of the Company and certified by Mr. Ramcharan Bervalla, Chief Financial Officer ("CFO") of the company in accordance with Regulation 33(2) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules 2015. The financial results were placed before the RP, the Chief Financial Officer and the Company Secretary on June 30, 2021 for their consideration. Accordingly, the audited financial results were considered and recommended by the members of the CoC. The CFO has provided the certificates and representation with responsibility in respect of the various internal controls, compliance and board matters pertaining to the period prior to Insolvency commencement date being 9th March, 2021. The RP has taken on record these audited financial results only to the limited extent of discharging the powers of the Board of Directors of the Company which has been suspended pursuant to initiation of CIRP and to ensure compliance under section 17 of the IBC, 2016.
6. The company is continuing to operate as a going concern even after commencement of CIRP as per the directions issued by the Hon'ble NCLT, Ahmedabad Bench vide order dated 9th March, 2021. Further, as per the provisions of the IBC, 2016, a resolution plan submitted by the resolution applicant is required to be approved by the members of the CoC. Further, once the Resolution Plan is approved by the members of the CoC, then the said Plan is required to be put before the Hon'ble NCLT by filing an Interceptor Application seeking approval of the plan in accordance with Section 31(6) read with Section 31 of the Code, 2016 and Regulations 39(4) of the Insolvency and Bankruptcy Code of India (Insolvency Process of Corporate Persons) Regulations, 2016. The future prospects of the company would be determined on the completion of CIRP. Hence, in view of the above facts and continuing operations of the Company, the financial results have been prepared on a going concern basis.
7. During the quarter and year ended on March 31, 2021, the company has incurred a total comprehensive loss of Rs 1611.66 Lakhs and Rs 1380.80 Lakhs respectively and as of March 31, 2021, the Company's accumulated losses amounted to Rs 6876.62 Lakhs as against the company net worth of Rs (2345.22 Lakhs) as at March 31, 2021. The Current Liabilities of the company as on March 31, 2021 exceeded total current assets by Rs (6646.42 Lakhs).
8. The company is having huge carried forward business loss and unabsorbed depreciation and has incurred loss in current year, so it is not probable that sufficient taxable income will be available in the future against which such carried forward loss can be set off. The resolution plan for the Company is implemented. Accordingly deferred tax assets of Rs 2054.71 Lakhs for the quarter and year ended at March 31, 2021 are presently not recognized.
9. In earlier year, the company had sold goods and have given advance to various parties (including enterprise owned or significantly influenced by the key managerial personnel) amounting to Rs 1602 Lakhs. The company had made all efforts to recover the dues, however as the amount could not be recovered till date and therefore the same has been written off in current period.
10. The company has not recognized interest payable on borrowings from financial creditors after the insolvency commencement date i.e. March 9, 2021. Accordingly, interest amounting to Rs 61.71 Lakhs after March 9, 2021 has not been recognized. The cumulative interest till March 31, 2021 is Rs 61 Lakhs. The same is not compliant with Ind AS 23 on "Borrowing Cost" and read with Ind AS 109 on "Financial Instruments". The provision for interest would be recognized, financial cost, total expenses, loss for the year and total comprehensive loss would have been higher by the equivalent amount as mentioned above having consequential impact on other current financial liability and other equity. This matter has accordingly been queried by the auditors in their review report.
11. The Net Block of the tangible assets and intangible assets as at March 31, 2021 is Rs 3963.37 Lakhs and Rs 1.62 Lakhs respectively. As explained in note no. 1 above, the Corporate Debtor is under CIRP and therefore the company has not taken into consideration any impact on the value of the tangible and intangible assets, if any, on preparation of financial results as required by Ind AS 10 on "Assets after the reporting period". Further, the company has also not made full assessment of impairment as required by Ind AS 36 on impairment of Assets, if any, as at March 31, 2021 in the value of tangible and intangible assets. Further, various other items of the balance sheet can also undergo changes based on the final decision of the Adjudicating Authority.
12. During the year the company has opted for Vivid Se Vishwas Scheme, 2020 in respect of disputed income tax matter before the appellate authority and the amount of Rs. 43.35 lakhs determined under the scheme is shown as expenditure under the head tax on settlement.
13. On March 24, 2020, the Government of India ordered a nationwide lockdown to prevent community spread of Covid-19 in India which resulted in significant reduction in economic activities. In developing the assumptions relating to the possible future uncertainties in the global economic conditions including conditions in India due to the ongoing covid-19 pandemic, the company has used the best available data and information as of the reporting period. Further, the company has also not made full assessment of impairment of the Company. Based upon the current estimates except as specified in point no 10 above the carrying amount of these assets are fully recoverable. The company believes that impact of Covid-19 on the company's financial results is not material.
14. The figures for the previous period/year have been re-grouped / re-arranged, wherever necessary, to correspond with the current period's classification / disclosure.

For Real Strips Limited
(a company under Corporate Insolvency resolution process vide NCLT order)

Ramcharan N. Bervalla
Chief Financial Officer
Taken on Record

CA Ramcharan Dhallam Choudhary
Insolvency Resolution Professional
IP Registration No. IBI/I/PA-001/ IP-P00157/2017-2018/10326

Place: Sari-Village
Date : 30th June 2021



ZEAL AQUA LIMITED
CIN: L0504932009PLC056270
Registered Office: At Opad GIDC Plot No. 4, 5, Ta Opad, Surat 394540, Gujarat
Tel.: +02621-220047; Website: www.zealgroup.com Email Id: zealgroup@gmail.com

Extract of audited Financial Result for the Quarter and year ended 31st March, 2021

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		31st March 2021	31st March 2020	31st March 2021	31st March 2020
	(Audited)	(Audited)	(Audited)	(Audited)	
1	Total Income from Operations	5662.201	8964.138	29747.422	23851.881
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	19.696	(303.667)	503.948	602.977
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	19.696	(303.667)	503.948	602.977
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(59.292)	(377.117)	424.960	529.527
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income)	(65.400)	(372.007)	418.852	534.637
6	Paid-up Equity Share Capital (face value of Rs.10/- each)	1260.660	1260.660	1260.660	1260.660
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	4545.806	4126.954
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (For continuing and discontinued operations)	(0.47)	(2.99)	3.37	4.20
1	Basic	(0.47)	(2.99)	3.37	4.20
2	Diluted	(0.47)	(2.99)	3.37	4.20

Note:
1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.zealgroup.com.
2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 30th June, 2021.
3. The Audit Report as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

For Zeal Aqua Limited
Shantilal Patel
(Chairman and Managing Director)
DN: 01362109

ECS Biztech Limited

CIN: L30007G21019PLC063970
Registered Office: 802, The First, ECS Corporate House, behind Keshavnagar, Party Plot, Off. 132 rd, Ring Road, Vastrapur, Ahmedabad 380015
Telephone: 9890005006; Website: www.ecscorporation.com; Email: secreta@ecscorporation.com

REGULATION 47(1)(b) OF SEBI (LODR) REGULATIONS, 2015

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2021

Particulars	Quarter Ended		Year Ended	
	31/03/2021	31/03/2020	31/03/2020	31/03/2021
	Audited	Unaudited	Audited	Audited
Total Income from Operations	33,28,49,027	56,35,88,303	41,96,50,715	1,21,97,92,702
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	83,40,237.02	2,18,79,893.09	27,52,384.24	1,71,29,286.99
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	83,40,237.02	2,18,79,893.09	27,52,384.24	1,71,29,286.99
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4,50,257.02)	(2,18,79,893.09)	(27,52,384.24)	(1,71,29,286.99)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income)	(4,50,257.02)	(2,18,79,893.09)	(27,52,384.24)	(1,71,29,286.99)
Paid Up Equity Share Capital	28,58,50,400.00	28,58,50,400.00	28,58,50,400.00	28,58,50,400.00
Earnings Per Share (face value of Rs. 10/- each) (For continuing and discontinued operations)	(0.02)	(0.08)	(0.11)	(0.35)
1. Basic	(0.02)	(0.08)	(0.11)	(0.35)
2. Diluted	(0.02)	(0.08)	(0.11)	(0.35)

Note:
1. The above is an extract of the detailed format of Standalone Audited Financial Results for the quarter and year ended on March 31, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Audited Financial Results for the quarter and year ended on March 31, 2021, is available on the website of Stock Exchange at www.bseindia.com as well as on the Company's Website at www.ecscorporation.com.
2. These Standalone Audited Financial Results have been reviewed by the Audit Committee in its meeting and were approved by the Board of Directors in their meeting held on June 30, 2021.

Gujarat reports 90 COVID-19 cases, 3 deaths

Ahmedabad : Gujarat has reported 90 fresh cases of COVID-19 on Wednesday. The addition of the fresh cases has taken Gujarat's total tally past 8.23 lakh. Over 2.84 lakh people were vaccinated in the state till 5 pm. Unfortunately, three deaths were reported in the state in the past 24 hours. The fresh fatalities have taken Gujarat's COVID-19 related death toll to 10,059. One death has been reported each from Ahmedabad, Vadodara and Devbhoomi Dwarka. Of the 90 fresh cases reported on Wednesday, 18 cases have been reported from Ahmedabad, 16 cases have been reported from Surat, 13 cases have been reported from Vadodara, and three cases have been reported from the state capital Gandhinagar. This apart, four cases were reported from Rajkot, Bhavnagar reported four cases, Mehsana reported one case, and four cases were reported from Jamnagar.

For ECS Biztech Limited
Sudhakar V. Vijay M Mandora
Managing Director

Place: Ahmedabad
Date: June 30, 2021

